

M.Com Semester - 2 (CBCS) Examination
May/June-2021 (OLD COURSE)
CORPORATE FINANCIAL REPORTING(CORE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન-૧ કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેક્ષણપ્રેક્ષણનો અર્થ અને હેતુઓ સમજાવો. (૧૪)

પ્રશ્ન-૨ નીચેનાં મહેશ લિમિટેડનાં પાકા સરવૈયા માટે સામાન્ય માપનું નાંણાકીય પત્રક તૈયાર કરો. (૧૪)

જવાબદારીઓ	31-03-20 ₹	31-03-21 ₹	મિલકતો	31-03-20 ₹	31-03-21 ₹
ઈક્વિટી શેરમૂડી	10,00,000	20,00,000	કાયમી મિલકતો	8,00,000	20,00,000
પ્રેફરન્સ શેરમૂડી	2,00,000	4,00,000	રોકાણો	6,00,000	2,00,000
સામાન્ય અનામત	2,00,000	5,00,000	દેવાદારો	4,00,000	8,00,000
નફા-નુકસાન ખાતું	4,00,000	6,00,000	આખર સ્ટોક	2,00,000	8,00,000
લેણદારો	2,00,000	4,00,000	રોકડ	1,00,000	2,00,000
ચૂકવવાનાં બાકી ખર્ચા	1,00,000	1,00,000			
	21,00,000	40,00,000		21,00,000	40,00,000

પ્રશ્ન-૩ નીચેની માહિતિનાં આધારે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ (CCA) હેઠળ ગિયરિંગ હવાલાની ગણતરી કરો. (૧૪)

વિગતો	01-04-2020 ₹	31-03-2021 ₹
રૂપાંતરિત ડિબેન્ચરો	10,00,000	12,00,000
બેંક ઓવરડ્રાફ્ટ	6,00,000	8,00,000
રોકડ	1,00,000	3,00,000
ભરપાઈ થયેલી શેરમૂડી	15,00,000	20,00,000
અનામતો	5,00,000	8,00,000
1. વેચાણ પડતરનો હવાલો(COSA)	₹ 2,00,000	
2. નાંણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો (MWCA)	₹ 1,50,000	
3. ધસારો	₹ 50,000	
કુલ	₹ 4,00,000	

પ્રશ્ન-૪ આર્થિક મૂલ્ય વૃદ્ધિ અને બજારમૂલ્ય વૃદ્ધિ વિશે સમજાવો.

(૧૪)

પ્રશ્ન-૫ નીચેના પર નોંધ લખો. (કોઇપણ બે)

(૧૪)

1. નાંણાકીય અહેવાલ પ્રેષણનાં ઉપયોગકર્તા
2. નાંણાકીય પત્રકોનું મહત્વ
3. વર્તમાન ખરીદશક્તિની હિસાબી પદ્ધતિ (CPP પદ્ધતિ)
4. મૂલ્યવૃદ્ધિ પત્રકનાં ફાયદાઓ

ENGLISH VERSION

Q.1 Explain the meaning and objectives of corporate financial reporting.

(14)

Q.2 Prepare common size financial statement for Balance sheets of Mahesh Ltd. as under.

(14)

Liabilities	31-03-20 ₹	31-03-21 ₹	Assets	31-03-20 ₹	31-03-21 ₹
Equity Share capital	10,00,000	20,00,000	Fixed Assets	8,00,000	20,00,000
Preference share capital	2,00,000	4,00,000	Investments	6,00,000	2,00,000
General Reserve	2,00,000	5,00,000	Debtors	4,00,000	8,00,000
Profit & Loss A/c	4,00,000	6,00,000	Closing stock	2,00,000	8,00,000
Creditors	2,00,000	4,00,000	Cash	1,00,000	2,00,000
Outstanding Expenses	1,00,000	1,00,000			
	21,00,000	40,00,000		21,00,000	40,00,000

Q.3 From the data given below calculate the gearing adjustment required under current cost Accounting (CCA) method.

(14)

Particulars	01-04-2020 ₹	31-03-2021 ₹
Convertible debentures	10,00,000	12,00,000
Bank overdraft	6,00,000	8,00,000
Cash	1,00,000	3,00,000
Paid-up share capital	15,00,000	20,00,000
Reserves	5,00,000	8,00,000
1. Cost of sales Adjustment (COSA)	₹ 2,00,000	
2. Monetary working capital Adjustment	₹ 1,50,000	
3. Depreciation	₹ 50,000	
Total	₹ 4,00,000	

Q.4 Explain about Economic value added and market value added.

(14)

Q.5 Write notes of the following. (any two)

(14)

1. The users of financial Reporting
2. The importance of financial statements
3. Current purchasing power accounting method (CPP method)
4. The advantages of value added statement
